



# RAN-1901130703050002

**M.A. (Sem. - III ) Examination November - 2025**  
**Economics (Paper - XV- ID : 3B) Banking and Insurance**

**Time: 2 Hours ]**

**[ Total Marks: 50**

**સૂચના : / Instructions**

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.  
Fill up strictly the above details on your answer book.
- (2) પ્રશ્ન નં. 1 ફરજિયાત છે.  
Question No. 1 is compulsory.
- (3) જમણી બાજુ દર્શાવેલા અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.  
Figures of the right indicate full marks of the questions.

Seat No.:

|  |  |  |  |  |  |
|--|--|--|--|--|--|
|  |  |  |  |  |  |
|--|--|--|--|--|--|

Student's Signature

**પ્ર. 1. નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં ઉત્તર આપો.**

**(10)**

1. ઓવરડ્રાફ્ટ અને કેશક્રેડિટનો અર્થ આપો.
2. અનુસૂચિત બેંક અને બિન અનુસૂચિત બેંક એટલે શું?
3. વીમાના મૂળભૂત સિદ્ધાંત જણાવો.
4. મનીબેંક પોલીસીનો ખ્યાલ જણાવો.
5. વીમાના લક્ષણો જણાવો.

**પ્ર. 2. “રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારત દેશની કરોડરજી સમાન છે” સમજાવો.**

**(13)**

**અથવા**

**પ્ર. 2. અ. બેંકિંગ સેવાના માર્કેટિંગમાં 6P નો ઉપયોગ સમજાવો.**

**(07)**

**બ. IMPS, RTGS અને NEFT સમજાવો.**

**(06)**

**પ્ર. 3. વીમાનો અર્થ, પ્રકારો અને મહત્વ સમજાવો.**

**(13)**

**અથવા**

**પ્ર. 3. જીવન વીમો એટલે શું? જીવન વીમાના મૂળભૂત સિદ્ધાંતો સમજાવો.**

**(13)**

**પ્ર. 4. ટૂંકનોંધ લખો (ગમે તે બે)**

**(14)**

1. આધુનિક બેંકના પ્રણાલીકાગત કાર્યો
2. નફાકારકતાનો ખ્યાલ
3. ATM ના લાભ-ગેરલાભ
4. ઈરડા (IRDA)

**ENGLISH VERSION**

**Q. 1. Answer the following questions briefly**

**(10)**

1. Give the meaning of overdraft and cash credit.
2. What is scheduled bank and non-scheduled bank?
3. Explain the basic principles of insurance.
4. Explain the concept of money back policy.
5. Explain the characteristics of insurance.

**Q. 2.** Explain "The Reserve Bank of India is like the backbone of the country of India" (13)

**OR**

**Q. 2. A.** Explain the use of 6P in marketing of banking services (07)

**B.** Explain IMPS, RTGS and NEFT. (06)

**Q. 3.** Explain the meaning, types and importance of insurance. (13)

**OR**

**Q. 3.** What is life insurance? Explain the basic principles of life insurance. (13)

**Q. 4. Write a short note (any two)** (14)

1. Systematic functions of a modern bank
  2. Concept of profitability
  3. Advantages and disadvantages of ATM
  4. IRDA
-